

Date: 13.11.2024

To, Gen. Manager (DCS) BSE Limited. P J Towers, Dalal Street, Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531913 (GOPAL IRON & STEELS COMPANY (GUJARAT) LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th September, 2024 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said unaudited financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 11th November, 2024.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED

MRS. KUNDANBEN PATEL MANAGING DIRECTOR

(DIN: 03063504)

K.B. Patel



HLE Glascoat Limited

CIN: L26100GJ1991PLC016173 Website: www.hleglascoat.com

Extract of Statement of Un-Audited Financial Results for the Quarter and Half year ended on 30th September, 2024

				C1	1-1					0	الممالمال الم	•	s except EPS
		Standalone					Consolidated						
Sr.	Particulars	Qι	ıarter Ende	d	Half Year Ended Year Ended		Quarter Ended		Half Year Ended		Year Ende		
No.		30.09.24	30.06.24	30.09.23	30.09.24	30.09.23	31.03.24	30.09.24	30.06.24	30.09.23	30.09.24	30.09.23	31.03.24
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
1	Total Income from Operation (net)	11,447.95	11,126.36	15,679.44	22,574.31	28,328.64	59,070.85	23,577.87	22,707.20	22,442.08	46,285.07	42,160.73	96,792.02
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items*)	81.09	112.56	1,033.53	193.65	2,087.64	3,666.92	1,953.23	692.73	1,801.72	2,645.96	3,114.13	6,398.68
3	Net Profit/(Loss) for the period before Tax, (after Exceptional and / or Extraordinary items*)	81.09	112.56	846.38	193.65	1,900.49	3,135.95	1,953.23	692.73	1,614.57	2,645.96	2,926.98	5,867.71
4	Net Profit/(Loss) for the period after Tax, (After Exceptional and / or Extraordinary items*)	5.31	143.15	612.96	148.46	1,384.32	2,663.84	1,442.14	542.02	1,082.10	1,984.16	2,011.20	4,088.86
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (loss) for period (after tax) and Other Comprehensive (After tax)]	1.68	139.52	613.13	141.20	1,384.65	2,631.41	2,207.57	345.57	1,126.23	2,553.14	2,020.83	4,127.25
6	Equity Share Capital	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31	1,365.31
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	-	-	-	-	-	-	-	-	-		-	-
	Earning PerShare (of Rs 2/- each)												
	a. (from continuing operations) Basic	0.01	0.21	1.12	0.22	2.38	4.43	2.11	0.79	1.81	2.91	3.30	6.52
8	Diluted	0.01	0.21	1.12	0.22	2.38	4.43	2.11	0.79	1.81	2.91	3.30	6.52
	b. (from discontinuing operations) Basic	-	-	(0.22)	-	(0.35)	(0.53)	-	-	(0.22)	-	(0.35)	(0.53)
	Diluted	-	-	(0.22)	-	(0.35)	(0.53)	-	-	(0.22)	-	(0.35)	(0.53)

The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchange(s): <u>www.bseindia.com, www.nseindia.com</u> and the Company: <u>www.hleglascoat.com</u>

The statutory auditors of the Company have carried out a limited review of the above consolidated financial results for the quarter and half year ended 30th September, 2024 and have issued an unqualified review report.

The Company had acquired a 35.56% profit share and controlling interest on 26th September, 2023 in Kinam Engineering Industries (the "Firm") and subsequently, the business of the Firm has been succeeded into Kinam Engineering Industries Private Limited. Accordingly, the financial results for the quarter and half year ended 30th September, 2024 are not comparable with the financial results for the quarter and half year ended 30th September

Previous period figures have been re-grouped/re-classified, wherever necessary

Date: 11h November, 2024

Place: Maroli

For HLE Glascoat Limited Sd/-**Himanshu Patel**

Managing Director

HDFC BANK

Branch Address: HDFC Bank, Trident, Race Course, Vadodara-390007. Tel.: 079-64807999

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Whereas the undersigned being the Authorised Officer of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Honble NCLT-Mumbai vide order dated 17th March 2023 (HDFC) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (The Act) and in exercise of power conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (The Rules) issued Demand Notices under Section 13(2) of the Act calling upon the Borrower(s)/Mortgagor(s), Legal Heir(s) and Legal Representative(s) as the case may be, whose name/s have been indicated in column (A) below, to pay the outstanding amount indicated in column (B) written against each of them within 60 days from the date of receipt of the said notice or within 60 days from date of publication of the demand notice in newspapers, as applicable.

days from date of publication of the demand notice in newspapers, as applicable.

However, upon the Borrower(s)/Mortgagor(s), Legal Heir(s) and Legal Representative(s) as the case may be having failed to repay the amount/s and/or discharge the loan liability in full, the Authorised Officer of HDFC Bank Limited has taken over possession and control of the respective immovable properties/ secured assets mortgaged with HDFC Bank Limited, described in column (C) herein below, to recover the said outstanding amount, in exercise of powers conferred on the Authorised Officer under Section 13(4) of the Act.

Further, Notice is hereby given to you all i.e. 1 Borrower(s)/Mortgagor(s), Legal Heir(s) and Legal Representative(s) as the case may be, under Rule 8 (6) of The Rules that the Authorised Officer shall now proceed to sell the immovable properties/ secured assets mentioned below by adopting any of the methods mentioned in Rule 8(5) of The Rules. Further, if the sale proceeds of such sale are not sufficient to cover the entire outstanding dues of HDFC Bank Limited, then (you all) the Borrower(s)/Mortgagor(s), Legal Heir(s) and Legal Representative(s) as the case may be shall be jointly and severally liable to pay the amount that falls short of the total dues in the respective loan account(s) to HDFC Bank Limited.

Now, Borrower(s)/Mortgagor(s), Legal Heir(s) and Legal Representative(s) as the case may be mentioned herein below in column (A) in particular and the public in general are hereby also informed that the said immovable properties/secured assets would be sold on "As is where is", "As is what is", and "Whatever there is' basis on the date specified in column (G) and on the time and venue as mentioned herein by inviting offers from the public vide e-auctions facility

For detailed terms and conditions of the sale, please refer to the link provided in HDFC Bank Limited (HDFC) Secured Creditor's website i.e. www.hdfc.com

Sr. No		Outstanding dues to be Recovered (Secured Debt) (Rs.)*	Description of the Immovable Property / Secured Asset (1 Sq. mtr. is equivalent to 10.76 Sq. ft.)	Type of Possession	Reserve Price (Rs.)	Earnest Money Deposit (Rs.)	Date of Auction and time
	(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1	MR. NIKHIL JAYANTIBHAI PATEL (BORROWER) MR. VISHAL J. DARJI (GUARANTOR)	RS.16,80,684/- as on 30 Nov., 2022*	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY FLAT-302, 3RD FLOOR, MARUTI HEIGHTS, TOWER - K, ADMEASURING SUPER BUILT UP AREA APPROXIMATELY 90 SQ. MTRS. S. NO. 1081, 1082, OPP. SATYAM EXOTICA, CHHANI - DUMAD ROAD, CHHANI, VADODARA - 390024.	Physical Possession	Rs.15,90,000/-	Rs.1,59,000/-	13 Dec., 2024 11:00 A.M. to 12:30 P.M.
2	MR. RAMSWAROOP KANARAM CHAUDHRI (BORROWER) MRS. SUMITRA KANARAM CHOUDHARY(CO-BORROWER)	Rs.12,69,093/- as on 31 July, 2023*	ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY PLOT 91/1, 91/2, SHREE SIDDHESHWAR HERITAGE, TOWER - E, ADMEASURING SUPER BUILT UP AREA APPROXIMATELY 67 SQ. MTRS. S. NO. 500, BLOCK 500, NR. PALM GREEN DUPLEX, OPP. L & T KNOWLEDGE CITY, N.H 8, AJWA - WAGHODIA RING ROAD, VADODARA - 390019.	Physical Possession	Rs.22,90,000/-	Rs.2,29,000/-	13 Dec., 2024 11:00 A.M. to 12:30 P.M.
3	MR. HITESH PATEL (BORROWER) MR. DHARMESHKUMAR PATEL (CO-BORROWER) M/S SHREEJI FOODS ENT. (CO-BORROWER) MR. BHASKAR KUMAR PATEL (CO-BORROWER) MR. BIPINKUMAR SURESHBHAI THAKKAR (GUARANTOR)	Rs.1,48,42,421/- as on 30 Nov., 2021*	ALL THAT PIECE AND PARCEL OF UNIT/SHOP NUMBER 7, 8, 9 AND 10 ON GROUND FLOOR SITUATED ON PLOT NO. K-119 IN WHICH UNIT - 7, CARPET AREA ADMEASURING 19.95 SQ. MTRS. (ON GROUND FLOOR), TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN LAND BEING 15.72 SQ. MTRS. UNIT - 8, CARPET AREA ADMEASURING 19.95 SQ. MTRS. (ON GROUND FLOOR) TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN LAND BEING 15.72 SQ. MTRS. UNIT - 9, CARPET AREA ADMEASURING 19.95 SQ. MTRS (ON GROUND FLOOR) TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN LAND BEING 15.72 SQ. MTRS. UNIT - 10, CARPET AREA ADMEASURING 19.95 SQ. MTRS (ON GROUND FLOOR) TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN LAND BEING 15.72 SQ. MTRS. UNIT - 10, CARPET AREA ADMEASURING 19.95 SQ. MTRS (ON GROUND FLOOR) TOGETHER WITH UNDIVIDED PROPORTIONATE SHARE IN LAND BEING 15.72 SQ. MTRS. WHEREBY TOTAL AREA OF THE SAID PROPERTIES 79.8 SQ. MTRS. ALL OF THEM IN A SCHEME CALLED 'VASHISHTHA VANIJYAM' SITUATED ON A PIECE OF LAND BEARING CONSOLIDATED CITY SURVEY NUMBER 549/A, MOUJE: VALLABH VIDYA NAGAR, DISTRICT: ANAND, SUB-DISTRICT: ANAND.	Physical Possession	Rs.1,20,00,000/-	Rs.12,00,000/-	13 Dec., 2024 11:00 A.M. to 12:30 P.M.

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization.

The Authorized Officer shall not be responsible for any error, misstatement or omission on the said particulars. The bidders are therefore requested in their own interest, to satisfy themselves with regard to the above and all other relevant details/material facts and information pertaining to the abovementioned immovable properties/secured assets before submitting bids. Statutory dues like property taxes/cess and transfer charges, arrears of electricity dues, arrears of water charges, sundry creditors, vendors, suppliers and other charges known and unknown, shall be ascertained by the bidder beforehand and the payment of the same be the responsibility of the buyer of Property/Secured Asset. Wherever applicable, it is the responsibility of buyer of secured assets to deduct tax at source (TDS) @1% of the total sell consideration on behalf of the resident owner (seller) on the transfer ovable property having consideration equal or greater then INR 50,00,000/- and deposit the sane with appropriate authority u/s 194 IA of Income Tax Act. 1961

Disclosure of Encumbrances o the best of the knowledge and information of the Authorised Officer of HDFC Bank Limited, there are no encumbrances in respect of the above immovable properties/ secured assets

Most Important Terms and Conditions > Bid incremental Amount for the Properties/Secured Assets mentioned would be Rs.10,000/- (Rupees Ten Thousand Only) for Sr. No. 1 & 2 and Rs.25,000/- (Rupees Twenty Five Thousand Only) for Sr. No. 3.

- > Inspection of all the above mentioned Properties/Secured Assets would from 10 AM till 4 PM, date for inspection of Properties/Secured Assets 22-11-2024 (Friday).
- > For any assistance related to inspection of the property, or for obtaining the E-Auction Bid Document and for any other queries, please get in touch our Authorized Partner I.e. M/s. Shriram Automall India Limited, through its Concern Person being MR. SHISHIR ZHALA, through their Centralized Mobile No. +918238038189, Website: https://eauctions.samil.in OR official of HDFC Limited through Mr.Hardik Shah Mobile. No. 89806-65665, Mr. Hardik Pandya Mobile No. 7228971677 and Mr. Dhaivat Vyas - Mobile No. 6358788055.
- > The last date of submission of bids in the prescribed e-auction Bid documents and EMD in stipulated manner is 12-12-2024 (Thursday).

For detailed terms and conditions of the sale, please refer to the link provided in HDFC Bank Limited (HDFC) Secured Creditor's website i.e. www.hdfc.com Date: 12-11-2024

For, HDFC Bank Ltd. **Authorised Officer**

Place: Vadodara Regd. Office: HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED
CIN: L27101GJ1994PLC022876

B-701, Nirman Complex, B/h. Navrangpura Bus Stand, Ahmedababd-380009 GJ IN EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2024 (Rs. in Lacs)

Sr No		Quarter ended on 30-09-2024	Quarter ended on 30-09-2023	Half Year ended on 30-09-2024	Year ended on 31-03-2024
1	Total Income from Operations	23.50	275.25	177.52	419.38
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-5.14	5.76	-1.1	5.52
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional				
	and / or Extraordinary items)	-5.14	5.76	-1.10	5.52
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	-5.14	5.76	-1.10	5.52
5	Total Comprehensive Income for	-0.14	0.70	-1.10	0.02
•	the period [Comprising Profit/				
	(loss) for the period (after tax)				
	and other Comprehensive				
_	Income (after tax)]	0.00	0.00	0.00	0.00
6 7	Equity Share Capital	491.71	491.71	491.71	491.71
1	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited				
	Balance Sheet of Previous Year	-557.65	-557.65	-557.65	-557.65
8	Earnings Per Share	-007.00	-007.00	007.00	007.00
Ŭ	(of Rs.10/- each) (for continuing				
	and discontinued operations)				
	Basic:	-0.10	0.12	-0.02	0.11
	Diluted:	-0.10	0.12	-0.02	0.11

Notes : (1) The above is an extract of the detailed format of Quarterly Financia Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.gopaliron.in)
(2) The result of the Quarter ended on 30th September, 2024 were reviewed by the Audit
Committee and approved by the Board of Director at its meeting held on 11-11-2024

By Order of the Board of Directors For, Gopal Iron and Steels Company (Gujarat) Limited

sd/- **Ms. Kundanben Patel** Managing Director - DIN: 03063504 Place: Ahmedabad Date: 11/11/2024

🎒 वैंक आंफ़ बढ़ौदा Umbhel Branch, At & Po. Umbhel, Tal. Kamrej, Dist. Surat Bank*of Baroda* Mob. 89800 26688, E- mail : umbhel@bankofbaroda.co.ir BOB/UMBHEL /ADV/2024-25/

NOTICE TO BORROWER

(Under Sub-Section (2) of Section 13 of the Securitization and
Reconstruction of Financial Assets and Enforcement of Security Interest
Act, 2002, hereinafter called 'Act')

Mr. Govindkumar Ghanshyam Ray (Borrower) Mrs. Jyoti Kumari Govindbhai Ray (Co-Borrower) Address: Plot No.74, Dharmabhakti Residency, Opp. Aradhana Dream, Jolva Patiya Road, Jolva, Taluk Palsana, Dis. Surat - 394305. Dear Sir/s.

Re: Credit facilities with our Umbhel Branch.

1. We refer to our letter No. Ref : ADV/Retail-00000024969 -LMS Dated 06-11-2018

conveying sanction of credit facility and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facility after providing facility account and the security interest created for such liability are as under: Nature Limit Rate O/c as on Unrealized Uncharged Penal Total amount

and Type of facility	Limit In Lacs	Rate of Interest	0/s as on 04.10.2024 (in Rs.)	Interest upto 08.10.2024 (in Rs.)	upto 08.07.2024 (in Rs.)	@ 2% simple Rate upto 08.10.2024 (in Rs.)	08.10.2024 any recovery (in Rs.)
Term Loan – (Housing Loan) 0730060 0001526	Rs. 6.26	9.60%	Rs. 5,69,605.00	Rs. 13,866.21	Rs. 5,377.19	Rs. 1,120.25	Rs. 5,89,968.64
Term Loan – (Housing Loan) Top Up	Rs. 3.00	11.35%	Rs. 2,84,272.00	Rs. 8,133.00	Rs. 2,694.76	Rs. 561.41	Rs. 2,95,661.17 (Recovery Rs. 10,000/ Dated 08/010/2024) Total Dues - 2,85,661.17
Total	Rs. 9.26		Rs. 8,53,877.00	Rs. 21,999.21	Rs. 8,071.95	Rs. 1,681.66	Rs. 8,75,629.81

Security Agreement with brief description of securities

Description of Security: - All that Piece and Parcel of immovable property bearing Plot

No.74, (as per KJP Block No. 211/74) admeasuring 40.18 Sq. mtr. DHARAMABHAKTI

RESIDENCY situated at land baring RS No. 151,173 Block No. 211 Village - Jolva,

Taltit Description of Security Cardinary in the Company of t Taluk Palsana, District Surat Standing in the name of Mr. Govindkumar Ghanshyam Ray

Rorrower), Mrs. Jyoti Kumari Govindbhai Ray (Co-Borrower). East: Plot No. 61/A, West: Society Road, North: Plot No: 73/A, South: Plot No: 75/A.

Security Agreement: The above mentioned property was mortgaged with Bank of Baroda Kamrej through an "Instrument of Deposit of Title Deed" dated 26.03.2019 bearing registration number **5172** registered with the office of Sub-Registrar, Palsana Dist. Surat. And again been extended through Instrument of Deposit of Title Deed dated 01/02/2021 bearing registration number 1204 with sub registrar's office at

Palsana.
CERSAI ID 400037142242
You are also liable to pay further contractual rate of interest on the above amount w.e.f.
04/06/2024 till realization. Since entire amount is overdue, you are also liable to pay penal interest of 2% p.a. on simple basis on the entire overdue amount. Please note that the Bank has calculated and claimed penal interest of 2% p.a. on simple basis. The Interest calculation sheet is enclosed herewith.

2. The outstanding stated above include further drawings, interest and other charges debited to the accounts up to 04/06/2024.

3. As you are aware, you have committed defaults in payment of installments of your Term Loan (Housing Loan) account which have fallen due for payment on 04/06/2024 and thereafter.

. Consequent upon the defaults committed by you, your loan account has beer classified as non-performing asset on 04/10/2024 in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon.

. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under subsection (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 8,53,877.00 (Rupees Eight Lakh Fifty Three Thousand Eight Hundred Seventy Seven Rupee Only) as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.

Please note that, interest will continue to accrue at the rates specified in para 1 abov for the credit facility until payment in full.

. We invite your attention to sub-section (13) of Section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that noncompliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act.

3. We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender /private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available.

D. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without

limitation, the right to make further demands in respect of sums owing to us. Date: 08-10-2024 Yours Faithfull Chief Manager, Authorised Officer

છેલાં ૧૦ વર્ષમાં માર્ગ અકસ્માતોમાં

દાયકામાં, લગભગ ૧૫.૩ લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયાં છે. આ સંખ્યા ચંડીગઢની વસ્તી કરતાં પણ વધુ છે. કેન્દ્ર સરકાર વારંવાર માર્ગ અકસ્માતોને ઘટાડવા પ્રયત્નો કરી રહી છે અને સુપ્રીમ કોર્ટે પણ આવાં મૃત્યુને રોકવા માટે સીટ બેલ્ટ અને હેલમેટ જેવાં કાયદાઓના કડક પાલન માટે પગલાં લેવા કહે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે દેશમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર ૧૦૦૦૦ કિલોમીટર દીઠ ૨૫૦ ની મોટા પાયે જાનહાનિને રોકવા માટે મંગાવવામાં આવે છે, ત્યારે જીવલેણ આસપાસ છે. આ આંકડો યુએસમાં વધુ પ્રયત્નો કરવામાં આવ્યાં નથી. ૫૭, ચીનમાં ૧૧૯ અને ઓસ્ટ્રેલિયામાં ૧૧ છે.

અગાઉનાં દાયકામાં એટલે કે ૧૨.૧ લાખ લોકોનાં જીવ ગયાં હતાં. લાખ કિમી થઈ છે. જ્યારે છેલાં દાયકામાં જાનહાનિમાં વધારો થયો છે આ માટે વસ્તી વર્ષે વધુ લોકોનાં મૃત્યુનું કારણ પ્રાથમિકતા નથી.

થશે. રાજ્યની ૮૧ બેઠકોમાંથી

બાકીની બેઠકો પર તા.૨૦ના રોજ

મતદાન થશે. જયારે બીજી તરફ

પ્રતિષ્ઠાજનક વાયનાડ લોકસભા બેઠક

સહિત કુલ ૪૭ વિધાનસભા બેઠક

પર પણ મતદાન થશે. વાયનાડમાં

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી

ચૂંટણી લડી રહ્યા છે અને ગઇકાલે

પ્રચારના પડખમ શાંત થતાં પહેલા

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ

વાયનાડમાં એક જબરી રેલી યોજી

હતી જેમાં રાહુલ ગાંધીએ આઇ લવ

વાયનાડ લખેલું ટી-શર્ટ પહેરીને સૌનું

ધ્યાન ખેંચી લીધું હતું અને ત્યારબાદ

વાયનાડમાં આ પ્રકારના હજારો ટી-

શર્ટ પહેરેલા યુવક અને યુવતિએ

શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીએ

લોકસભા ચૂંટણીમાં જે રીતે

નામ બદલલ છ

મારૂ જૂનું નામ યાસીન અબ્દુલહારૂન

ખાન હતું તે બદલીને નવું નામ યાસીન

અબ્દુલહારૂન મેમણ રાખેલ છે.

એડ્રેસઃ ૭૦૫, ૭મો માળ,

અમ્બર-૨, રેસીડેન્સી, સરખેજ,

અમદાવાદ

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ મેગલબેન મિતુલકુમાર

પ્રજાપતિથી બદલીને નવું નામ

મેઘલબેન મિતુલકુમાર પ્રજાપતિ કરેલ

છે. ડી/૨૦૪ ગ્રીન આઇરીશ

એપાર્ટમેન્ટ, કે.કે.નગર,

ઘાટલોડીયા, અમદાવાદ

નવી દિલ્હીઃ ભારતમાં છેલાં એક વધારો, રસ્તાની લંબાઈ અને રસ્તાની લંબાઈ અને વાહનોમાં

કેન્દ્રીય માર્ગ ડેટા અનુસાર દર ૧૦,૦૦૦ કિલોમીટર દીઠ ૨૫૦ જેટલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કરોડથી વધીને ૨૦૨૪ માં લગભગ અધિકારીએ જણાવ્યું હતું કે ટોચનાં એકત્રિત કરવામાં આવેલાં ડેટા મુજબ ૩૮.૩ કરોડ થઈ છે અને રસ્તાની અધિકારીઓ ભાગ્યે જ જૂનિયરો લંબાઈ ૨૦૧૨ માં ૪૮.૬ લાખ પાસેથી રોડ અકસ્માત માટે રીપોર્ટ ૨૦૦૪-૧૩ માં, માર્ગ અકસ્માતમાં કિમીથી વધીને ૨૦૧૯ માં ૬૩.૩ માંગે છે, ભલે ત્યાં એક ડઝનથી વધ્

તેમજ અપૂક્ષ ઉમેદવારના જંગ જેવી

રાહલએ પ્રચારના આખરી

તબક્કામાં આઇ લવ

આ બેઠક રાજ્યભરમાં ધ્યાન ખેંચી

ગઇ છે અને તે બેઠક જીતવા ભાજપે

એડી ચોટીનું જોર લગાવી દીધું છે.

વાયનાડના પરિણામો રાજ્યના

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ યાસ્મિન

યાસીનખાન હતું તે બદલીને નવું

નામ યાસ્મિન યાસીન મેમણ

રાખેલ છે. એડ્રેસઃ ૨૫, તયબૈ

ડૂપ્લેક્ષ, બાગે મસીરા, અમદાવાદ

નામ બદલલ છ

હું કાળુભાઈ પટેલ મેં મારા સગીર

નામ બદલેલ છે

મેં મારી સગીર પુત્રીનું જૂનું નામ હિર

મિતુલકુમાર પ્રજાપતિથી બદલીને નવું

નામ હીર મિતુલકુમાર પ્રજાપતિ કરેલ

છે. ડી/૨૦૪ ગ્રીન આઇરીશ

એપાર્ટમેન્ટ, કે.કે.નગર,

ઘાટલોડીયા, અમદાવાદ

વિધાનસભા ચૂંટણીના પ્રથમ કરી જેમાં હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી

તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ

વાહનોની સંખ્યામાં વધારો થતાં વધારો ન હોઈ શકે. તેઓએ ઉમેર્યું અકસ્માતમાં વધારો થયો હોવાનો હતું કે જ્યારે તે જાણીતું છે અને અંદાજ છે. નિષ્ણાતો કહે છે કે આ ઘણી વખત હાઇલાઇટ કરવામાં આવે છે કે માર્ગ સલામતી એ બહ-ક્ષેત્રીય મુદ્દો છે જેમાં સરકારી વિભાગો, **પરિવહન મંત્રાલયનાં** હિતધારકો અને એનજીઓ વચ્ચે વધુ સહકારની જરૂર છે, પરંતુ સંબંધિત એજન્સીઓએ આ દિશામાં પુરતું કામ કર્યુ નથી.

भूतपूर्व टोयनां पोवीस અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે એક વણઉકેલાયેલી હત્યા માટે અધિકારીઓ પાસેથી ખુલાસો માર્ગ અકસ્માતના કિસ્સામાં આવી સરકારી ડેટા દર્શાવે છે કે રજીસ્ટર્ડ કાર્યવાહી શા માટે કરવામાં આવતી વાહનોની સંખ્યા ૨૦૧૨ માં ૧૫.૯ નથી. દિલ્હી પોલીસનાં ભૂતપૂર્વ અકસ્માતમાં મૃત્યુ થયાં હોય. રોડ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દર ક્રેશ એ તમામ એજન્સીઓ માટે

આજે ઝારખંડની ૪૩ વિધાનસભા બેઠક

ઉપરાંત વાયનાડની પેટા ચૂંટણીનું મતદાન દેશમાં કરી સર્જાપેલા ચૂંટણીના રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો રાજકારણ પર અસર પાડશે તે વાતાવરણમાં આવતીકાલે ઝારખંડમાં જીતી હતી તેમાંથી વાયનાડ ખાલી નિશ્ચિત છે.

કુલ ૪૭ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીમાં મતદારો ફેંસલો કરશે

અમલ તથા ચૂંટણી પ્રક્રિયાને કોઇ

AHMEDABAD MUNICIPAL CORPORATION **MAHANAGAR SEVA SADAN**

(S.W.M. Department)

E-TENDER NOTICE No.19/2024-25

વાયનાડ લખેલું ટી-શર્ટ પહેરીને આકર્ષણ જમાવ્યું: પ્રિયંકા સાથે રેલી DEPARTMENT, AHMEDABAD MUNICIPAL

: Dt: 05.12.24 Up to 16.00 Hrs Date of Physical Submission

All Details may be download of above notice will be available in www.tender.nprocure.com and www.tender.nprocure.com MUNICIPAL COMMISSIONER

DEV INFORMATION TECHNOLOGY LIMITED CIN: L30000GJ1997PLC033479

haltej, Ahmedabad, Gujarat - 380059 || Ph : +91-9429899852 / 53 Email: cs@devitpl.com || Website: https://www.devitpl.com

NOTICE FOR RECORD DATE

પુત્રનું જૂનું નામ સંકેતકુમાર પટેલ હતું તે બદલીને નવું નામ સંકેતકુમાર ચૌધરી રાખેલ છે. મુ.ઃમોટા વડાદલા, પો.નાના વડાદલા, મહીસાગર, લુશાવાડા-૩૯૯૨૩૨

> Company as on closing hours of Tuesday 26th November, 2024 will be entitled to receive Interim dividend. The intimation is also available on the company website https:/

> www.devitpl.com/ and on website of the stock exchange https://www.nseindia.com/ and https://www.bseindia.com/

Date: 13/11/2024 sd/- Krisa Shah Place : Ahmedabad

DEV INFORMATION TECHNOLOGY LIMITED

CIN: L30000GJ1997PLC033479

Registered Office : 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad, Gujarat - 380059 || Email: cs@devitpl.com || Website: https://www.devitpl.com || Ph: +91-94298 99852 / 53 EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF-YEAR ENDED SEPTEMBER 2024 (Rs. in Lakhs, except EPS)

- 1		Standalone			Consolidated				
S		Quarter ended on 30/09/2024 (Unaudited)	Quarter ended on 30/06/2024 (Unaudited)	Quarter ended on 30/09/2023 (Unaudited)	Half Year ended on 30/09/2024 (Unaudited)	Quarter ended on 30/09/2024 (Unaudited)	Quarter ended on 30/06/2024 (Unaudited)	Quarter ended on 30/09/2023 (Unaudited)	Half Year ended on 30/09/2024 (Unaudited)
1	Total Income from Operations	4,384.45	3,044.58	3,051.09	7,429.03	4824.49	3,573.00	2,850.30	8397.49
2	Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items)	1061.44	421.20	194.48	1,482.64	945.01	478.76	196.16	1,423.77
3	Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items)# Net Profit for the period after tax (after	1061.44	421.20	194.48	1,482.64	945.01	478.76	196.16	1,423.77
ľ	exceptional and / or extraordinary items)	914.29	331.15	162.36	1,245.44	811.11	371.75	165.30	1,182.86
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	910.94	327.76	161.96	1,238.70	806.87	369.39	164.90	1,176.25
6	Paid-up Equity Share Capital (face value of Rs.5/- each)	1,124.23	1,124.23	1,106.71	1,124.23	1,124.23	1,124.23	1,106.71	1,124.23
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		_	_	_	_	_		_
8	Earnings Per Share (face value of Rs.10/- each) (for continuing and discontinued operations)								
L	1) Basic 2) Diluted	4.07 4.06	1.47 1.47	0.73 0.73	5.54 5.52	3.74 3.73	1.56 1.55	(0.10) (0.12)	5.30 5.28

Notes The above is an extract of the detailed format of Second Quarter and Half Year ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Second Quarter and Half Year ended Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and

Bombay Stock Exchange at www.bseindia.com and on the website of the Company at the www.devitpl.com. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 12, 2024.

The Limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

The financial results for the Quarter ended September 30, 2024 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable

For and on behalf of Board of Directors of Dev Information Technology Limited

Date: 13/11/2024 sd/- Jaimin J. Shah Managing Director - DIN: 00021880 Place: Ahmedabad



ગુજરાતમાં કચ્છમાં ખાવડા ખાતે અદાણી ગૃપના વિશ્વના સૌથી મોટા રીન્યુએવલ એનર્જી પાર્ક અને દેશના સૌથી મોટા બંધ અને ઇન્ડસ્ટ્રીઅલ હબની મુલાકાતે આવેલ યુરોપિયન યુનિયનના દેશો બેલ્જીયમ, ડેન્માર્ક અને જર્મનીના રાજદૂતો સાથે ગુપના વડા ગૌતમ અદાણી પોઝ આપી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આચારસંહિતા

મહારાષ્ટ્રમાં થાણેમાં રૂા.૨૩.૪૧ કરોડની રોકડ અને દાગીના જપ્ત

અન્યાયી વગથી દૂર રાખવાની

કટિબદ્ધતાઓ દર્શાવે છે. થાણે શહેરમાં

ચંટણી મેદાનમાં રહેલા અગ્રણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચંટણીને લઇ આચારસંહિતા લાગુ થયા બાદ થાણોમાં અત્યાર સુધીમાં સત્તાવાળાઓએ રોકડ, દાગીના તથા અન્ય વસ્તુઓ સહિત ૨૩.૪૧ કરોડની મતા જમ કરી હતી, જ્યારે દહિસરમાંથી ૧.૪૩ કરોડનું સોનું પકડવામાં આવ્યું હતું.

૧૧ નવેમ્બર સુધી કુલ ૧૮ મતદાન ક્ષેત્રોમાંથી ૧૨.૪૧ કરોડની રોકડ, ૨.૨૨ કરોડ રૂપિયાનો દારૂ, ૧.૬૪ કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનો નશીલો પદાર્થ, ૨૩.૨૬ કરોડ રૂપિયાના દાગીના તથા અન્ય કીમતી ચીજવસ્તુઓ તેમ જ ૬.૮૯ કરોડની કિંમતની મફત વિતરણ માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અશોક શિંગારેએ જણાવ્યું હતું કે આ પગલાંઓ જિલ્લા વહીવટીતંત્રની આચારસંહિતાના

Name of work:-PROVIDING AND FIXING WIRE FENCING AT KARKASH DEPO IN SOUTH ZONE LAMBHA WARD IN SOLID WASTE MANAGEMENT ENGINEERING

CORPORATION (RE INVITE)

Date of online Submission :- Dt: 14.11.24 to Dt: 04.12.24 Up to 18.00 Hrs

Tender Opening Date

Registered Office: 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway

Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (listing Obligations and Disclosure Requirements), 2015 and in accordance with the approval of Board in their meeting held on 12th November, 2024 the company has fixed record date i.e Tuesday 26th November, 2024 for the payment of Interim Dividend for the FY 2024-2025, declared by the Board at its meeting held on November 12th, 2024.

The members whose name appears in the Register of Members of the

For and on behalf of Board of Directors of

Dev Information Technology Limited Company Secretary & Compliance Officer

ભારતમાં જીઓને ટકકર આપવા માટે મસ્ક તૈયારઃ સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે

ન્યુ દિલ્હી : ભારતમાં સ્પેસએક્સના માલિક એલોન મસ્કની સ્ટારલિંકને લાઇસન્સ આપવાની પ્રક્રિયા હવે ટૂંક સમયમાં આગળ વધી શકે છે. અહેવાલો અનુસાર, સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંક સરકારના ડેટા લોકલાઇઝેશન અને સરક્ષા નિયમોને પૂર્ણ કરવા માટે સંમત થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ વિભાગ સાથેની મીટિંગમાં, સ્ટારલિંકે સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ લાયસન્સ માટે ડેટો લોકલાઇઝેશન અને સુરક્ષા સંબંધિત નિયમો પર સહમતિ દર્શાવી છે, પરંતુ કંપનીએ હજુ સુધી કરાર ફાઇલ કર્યો નથી.

સેટે લાઇટ (GMPCS) લાયસન્સ દ્વારા ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યનિકેશન એ સેટેલાઇટ ઈન્ટરનેટ ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવ સેનાના વિધાનસભ્ય પ્રતાપ સેટ કરવાની દિશામાં પ્રથમ પગલું સરનાઇકનો સમાવેશ છે. ચૂંટણી પંચની છે. જે પછી નજીવી અરજી ફી ભરીને પરીક્ષણ માટે સ્પેક્ટ્રમ મેળવી શકાય છે.

સ્ટેટિક સર્વેલન્સ ટીમે (SST) દહિસર વિસ્તારમાંથી ૧.૪૩[`] કરોડની કિંમતનું ૧.૯૫ કિલો સોનું પકડી પાડ્યું હતું. નીડો હોમ ફાઇનાન્સ લિ. nido (અગાઉની એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ)

રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે : ટાવર ૩, ૫મે માળે, વિંગ 'B', કોહિનૂર સીટી મોલ, કોહિનૂર, કિરોલ રોડ, કુર્લા (પ.) મુંબઈ- ૪૦૦૦ ૭૦ રેજનલ ઓફિસઃ ઓફિસ ૩૦૧,૩૦૨,૩૦૩,૩૦૪, ૩જે માળે, થર્ડ આઇ વિઝન, શિવાલિક પ્લાઝા સામે, આઇઆઇએમ પાસે, પાંજરાપોળ કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે)(નિયમ ૮ (૧) આથી. નીચે સહી કરનારે નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ(અગાઉ એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટે

તરીકે જાણીતી)ના અધિકૃત અધિકારી તરીકે ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (કાયદો), ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨) હેઠળ આપેલ સત્તાને ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના ચનિયમ રૂ સાથે વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારોનો ઉપયોગ કરીને તા. ૧૦-૦૫-૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટિસ મોકર્લ હતી, જેમાં હરિશ્રંદ્ર અરવિંદભાઈ વસાવા(દેવાદાર), ચિરાગ હરેશયંદ્ર વસાવા (સહ-દેવાદાર) અને જમનાભેન હરેશચંદ્ર વસાવા (સહ-દેવાદાર)ને નોટિસમાં જણાવેલ ૨કમ રૂ.૨૨,૮૮,૬૧૭.૨૫/-(અંકે રૂપિયા બાવીસ લાખ અઠ્ઠચાસી હજાર છસો સત્તર અને પૈસા પચીસ પૂરા) એ નોટિસ મળવાની તારીખથી દિન[°] ૬૦માં ચૂકવી

. સદરહુ દેવાદાર રકમ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈને અત્રે દેવાદાર તથા જાહેર જનતાને નોટિસ આપવામ આવે છે કે નીચે સહી કરનારાએ સદર કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૪) ને ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ પૈકી નિયમ ૮ સાથે વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારથી નીચે જણાવેલ મિલકતનો ફિઝિકલ કબજો એડિ. ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, વડોદરા કેસ નં. ૧૯૮૫/૨૦૨૪ દ્વારા તા.૦૪-૧૦-૨૦૨૪ના આદેશની કાર્યવાહીમાં કૉર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરેલ શ્રી. પી.આર. ડાભી મારફતે અ વર્ષ ૨૦૨૪ના નવેમ્બર માસની ૧૧મી તારીખે લીધો છે.

દેવાદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણ આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા રૂ.૨૨,૮૮,૬૧૭.૨૫/-(અંકે રૂપિયા બાવીસ લાખ અફ્ઠ્રુંચાસી હજાર છસો સત્તર અને પૈસા પચીસ પૂરા) અને એની પરના વ્યાજ સાથેની રકમ માટે નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ(અગાઉ એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)ના ચાર્જને અધીન ગણાશે. સિક્યોર્ડ અસ્ક્યામતો છોડાવવાની ઉપલબ્ધ સમયમર્યાદા અંગે સરફ્રૈસી કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન(૮ તરફ દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

મિલકતની સૂચિ

રજિસ્ટ્રેશન અને પેટા જિલ્લો વડોદરા જિલ્લો ખાતે મોજે બિલના બિનખેત પ્લોટ તે બ્લોક/રે.સ.નં.૪૩૫, જૂનો રે.ન ૬૧૬, માપણી ૩૪૪૦ ચો.મી.,ટી.પી. સ્ક્રિમ નં.૧, એફ.પી. નં.૬૮ માપણી ૨૬૨૩ ચો.મી. તે પરમ એસ્પાય તરીકે જાણીતી ઇમારતમાં, ટાવર -એ, પાંચમે માળે, ફ્લેટ નં. એ-૫૦૩, બાંધકામ કાર્પેટ માપણી ૪૮.૮૬ ચો.મી. ગાંધકામ બિલ્ટ અપ એરિયા માપણી પદ્દ.૩૨ ચો.મી., ખુલ્લી અગાસી ૩.૯૪ ચો.મી., જમીનમાં અવિભાજિ હિસ્સો ૨૦.૬૬ ચો.મી. સદર મિલકતની સીમાઓ છેઃ ઉત્તરેઃ લિફ્ટ અને પેસેજ, ફ્લેટ નં. એ-૫૦૪, દક્ષિણેઃ સોસાયર્ટ માર્જિન જમીન, પૂર્વે: ફ્લેટ નં. એ-૫૦૨, પશ્ચિમે: ૧૫.૦૦ મી. રોડ

સ્થળઃ વડોદરા તારીખઃ ૧૧-૧૧-૨૦૨૪.

જાહેર નોટીસ

ષાંધીનગર ના મોજે ગામ અડાલજની સીમના બિલ્ડિંગ સ્વરૂપ-૨ માં 'બી વિંગ' માં ફ્લેટ નં. ૧૧૦૧૪

ચચુડાના મંજૂર પ્લાન મુજબ પ્લોટ નંબર R૧ ની જમીન પર ખુંધવામાં આવેલ બિલ્ડિંગના નામ સ્વરૂપ-૨માં ફલેટ નંબર ૧૧૦૧૪ ૧૧૪.૫૫ ચોરસ મીટરનું માપન. અગિયારમા માળે ૩૪.૬૧ ચોરસ મીટરની અવિભાજિત જમીન સાથે. ૬૦૬૨૧.૪૪ ચોરસ મીટરની બિન-ખેતી જમીન પર બાંધવામાં આવેલી સામાન્ય

સુવિધાઓ અને સુવિધાઓનો ઉપયોગ કરવાનો અધિકાર સાથે સામાન્ય પ્લોટ અને સામાન્ય રસ્તાઓન

અવિભાજિત હિસ્સાનો સમાવેશ કરીને. બ્લોક નં. ૪૪૪/૨૬૦ પૈકી જના બ્લોક નં. ૫૦૨ની જમીન. જના મ્લોક નં. ૫૦૬, જૂના બ્લોક નં. ૫૦૭, જૂના બ્લોક નં. ૫૦૯,ના સબ પ્લોટ નંબર ઇ૧ (GUDAના રેકોર્ડ

૪૪૪(પૈકી)નો ભાગ બનાવે છે (ત્યારબાદ યોજનામાં ધ સેઇડ લેન્ડ અથવા ધ શેડ્યૂલ લેન્ડ તરીકે ઓળખાય

છે) અંબા ટાઉનશીપ સેક્ટર-૪ તરીકે ઓળખાય છે, જે અંબા ટાઉનશીપ× ખાતે આવેલ છે. મૌજે: અડાલજ,

તાલુકોઃ ગાંધીનગર ખાતે રજીસ્ટ્રેશન જીલ્લા અને ગાંધીનગરના ના હક્ક તથા સ્કીમની જમીનમાં આવેલ

આંતરિક રોડ-રસ્તા તથા સાર્વજનિક પ્લોટની જમીનમાં વણ વહેચાયેલ વરાડે પડતા હક્ક, હિસ્સા તેમજ

વપરાશી હક્કો સહીતની સ્થાવર મિલ્કત, કે તે સ્થાવર મિલ્કત ૧) નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ અને ૨)

કમલાબેન નગીનભાઈ પટેલ એ તા..૦૨/૧૧/૨૦૧૬ ના રોજ સબ-૨જીસ્ટ્રારશ્રી, ગાંધીનગર ની કચેરીમાં

અનુક્રમ નંબર ૧ ૬ ૪ ૮૯ થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થી સંયુક્ત રીતે વેચાણ રાખેલ છે. ત્યારબાદ નગીનભાઈ

ડાહ્યાભાઈ પટેલ નં તા ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ Royal London Hospital. Whitechapel Road.

.ondon મુકામે અવસાન થયેલ છે. નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ નું અવસાન થયેલ હોઈ ગુજરનાર

નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ ના સીધી લીટી ના વારસદારો ૧) કમલાબેન નગીનભાઈ પટેલ(પત્ની) ૨)

વૈષ્ણવ સુનીતાબેન મિલન(પુત્રી) છે., અને તેઓ જણાવે છે કે સ્વ. નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ ના ઉપરોક્ત

અમો વારસદાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ વંશ, વાલી, વારસો નથી. સદરહુ મિલકત સ્વ નગીનભાઈ ડાહ્યાભાઈ

પટેલ ના ઉપરોક્ત વારસદારોના નામ. અંબા ટાઉનશીપ સેક્ટર-૪ રેસીડન્સ વેલ્કેર એસોસીએશનમાં સદરહ

ફલેટમાં સભાસદ તરીકે ટ્રાન્સફર કરવાની માંગણી કરેલ છે, તથા સદરહુ મિલ્કત તેઓની કુલ સ્વતંત્ર, માલિકી,

છે. જેથી આ વિશે કોઈને કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર હોય અથવા સદરહ મિલ્કત પર કોઈ વ્યક્તિ કે

સંસ્થાનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દર, દાવો, ખોરાકી-પોપાકી કે કોઈપણ જાતનો

અધિકાર વેચાલથી, બાનાખતથી, ગીરો, બક્ષીસ, લીયનથી અથવા કોઈપણ જાતના બોજા, ચાર્જ હોય તો તેની

જાણ અમોને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે રજી. પોસ્ટ એ.ડી. થી

કેખિતમાં અથવા રૂબરૂમાં અમારા નીચે જણાવેલ સરનામે કરશો. જો તેમ કરવામાં કસુર થશે તો તેઓએ પોતાનો હક્ક, હિત, હિસ્સો અમારા અસીલની તરફેણમાં જવા દીધેલ છે. વેવ કરેલ છે, તેમ ગણી મુદ્દત વિત્યે

ઉપરોક્ત વારસદારોના નામ સ્વ. નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ ના વારસદાર તરીકે. ૧) કમલાબેન નગીનભાઈ

પટેલ(પત્ની) ૨) વૈષ્ણવ સુનીતાબેન મિલન(પુત્રી) અંબા ટાઉનશીપ સેક્ટર-૪ , રેસીડન્સ વેલ્ફેર

એસોસીએશનના રેકર્ડમાં સદરહુ ફલેટના સભાસદ તરીકે દાખલ કરવામાં આવશે અને અમારા અસીલ ને

ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ આપી દેવામાં આવશે . ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી.

એડવોકેટ, હરેશ એમ વિઠલાણી (ચ્'રક૮૮/૨૦૦૧) સરનામું ૯૧૦, ઇલાઇટ બિલ્ડીંગ , કારગીલ પેટ્રોલ પંપ પાસે,

સોલા , અમદાવાદ - ૩૮૦૦૬૯

તારીખ :- ૧૧/૧૧/૨૦૨૪ મો. ૯૪૨૬૨૨૯૦૨७

બ્જા, ભોગવટાની આવેલી હોવાનું જણાવી તેઓ અમારી પાસેથી ટાઈટલ ક્લીયર સર્ટીફોંકેટ ની માંગણી કરે

બ્લોક નં. ૫૧૦, જૂના બ્લોક નં. ૫૧૧ અને જૂના બ્લોક નં. ૫૧૨/એ એકીકૃત બ્લોક

આથી જાહેર જનતાને જણાવવાનં કે. રજીસ્ટેશન ડીસ્ટીકટ ગાંધીનગર ના સબ-ડીસ્ટીકટ અને તાલકા

સહી/- અધિકૃત અધિકાર્ર વતી નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉ એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)

સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓ માટે દેશમાં સંપૂર્ણ કેટા રાખવા ફરજિયાત છે.

સુરક્ષા સંબંધિત નિયમો અનુસાર દેશમાં કાર્યરત સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓ માટે તમામ

સ્ટારલિંકે સરકારના ડેટા સુરક્ષા નિયમો સાથે સહમતી દર્શાવીઃ તુર્તમાં લાઈસન્સ પ્રક્રિયા કરશે

ડેટા દેશની અંદર જ રાખવો સર્વિસીસ ફરજિયાત છે. સ્ટારલિંકને એ પણ સમજાવવાની જરૂર પડી શકે છે કે જો ઇન્ટેલિજન્સ એજન્સીઓને ડેટાની જરૂર હોય તો તેને કેવી રીતે

> સ્ટારલિંકે ઓક્ટોબર ૨૦૨૨માં લાઇસન્સ માટે અરજી કરી હતી

સ્ટારલિંકે ઓક્ટોબર ૨૦૨૨માં આ લાઇસન્સ માટે અરજી કરી હતી. આ પછી, કંપનીએ સ્પેસ રેગ્યુલેટર, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) પાસેથી મંજૂરી માટે પણ અરજ કરી હતી. IN-SPACE સાથેની અરજી પણ આગળ વધી છે, પરંતુ અંતિમ

કિંમતો અને સ્પેક્ટ્રમ કાળવણીના નિચમો ભારત સરકાર નક્કી કરશે

મંજૂરી માટે વધારાની વિગતો

માંગવામાં આવી રહી છે.

સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ ભારતમાં ત્યારે જ શરૂ થશે જ્યારે સરકાર કિંમતો અને સ્પેક્ટ્રમ ફાળવણી માટેના નિયમો નક્કી કરશે. આ પ્રક્રિયા ત્યારે જ શરૂ થઈ શકે છે જયારે ટેલિકોમ રેંગ્યલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તેની ભલામણો જારી કરે, જે ડિસેમ્બરના અંત સુધીમાં

nido

નીડો હોમ ફાઇનાન્સ લિ.

અગાઉની એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ)

રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે : ટાવર ૩, ૫મે માળે, વિંગ 'B', કોહિનૂર સીટી મોલ, કોહિનૂર, કિરોલ રોડ, કુર્લા (૫.) મુંબઈ- ૪૦૦૦ કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે)(નિયમ ૮ (૧)

અપેક્ષિત છે.

આથી. નીચે સહી કરનારે નીડો હોમ કાઇનાન્સ લિમિટેડ(અગાઉ એડેલવેઇસ હાઉસિંગ કાઇનાન્સ લિમિટે તરીકે જાણીતી)ના અધિકૃત અધિકારી તરીકે ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (કાયદો), ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨) હેઠળ આપેલ સત્તાને ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના ચનિયમ રૂ સાથ વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારોનો ઉપયોગ કરીને તા. ૧૦-૦૬-૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટિસ મોકર્લ હતી, જેમાં કૃષ્ણ ગિરી (દેવાદાર) અને દેસુ દેવી (સહ-દેવાદાર)ને નોટિસમાં જણાવેલ ૨કમ રૂ ૧૦,૮૫,૬૯૯.૪૬/-(અંકે રૂપિયા દસ લાખ પંચ્યાસી હજાર છસો નવાણું અને પૈસા છેંતાલીસ પૂરા) અને રૂ ૧,૯૨,૬૩૫.૫૫/- (અંકે રૂપિયા એક લાખ બાણું હજાર છસો પાંત્રીસ અને પૈસા પંચાવન પૂરા) એ નોટિં મળવાની તારીખથી દિન ૬૦માં ચૂકવી જવા જણાવેલ.

સદરહુ દેવાદાર ૨કમ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈને અત્રે દેવાદાર તથા જાહેર જનતાને નોટિસ આપવામ ગાવે છે કે નીચે સહી કરનારાએ સદર કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૪) ને ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ પૈકી નિયમ ૮ સાથે વંચાયે લેતા હેઠળ મળેલ અધિકારથી નીચે જજ્ઞાવેલ મિલકતનો ફિઝિકલ કબજો ૨જા એડિ.સિ.સિવિલ જજ, અમદાવાદ દ્વારા કેસ નં. પગ્રદ૧/૨૦૨૪માં દ્વાર ા.૦૩-૧૦-૨૦૨૪ના આદેશની કાર્યવાહીમાં કૉર્ટ કર્મિશનર તરીકે નિયુક્ત કરેલ શ્રી. એ.એમ. ગોવાર્ષ મારફતે આ વર્ષ ૨૦૨૪ના નવેમ્બર માસની ૦૯મી તારીખે લીધો છે.

. દેવાદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવર્ણ ગાપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા રૂ. ૧૦,૮૫,∉૯૯.૪૬/ -(અંકે રૂપિયા દસ લાખ પંચ્યાસી હજાર છસો નવાલું અને પૈસા છેંતાલીસ પૂરા) અને રૂ. ૧,૯૨, ૬૩૫.૫૫/- (અંકે રૂપિયા એક લાખ બાહું હજાર છસો પાંત્રીસ અને પૈસા પંચાવન પૂરા) અને એની પરના વ્યાજ સાથેની રકમ માટે નીડો હોમ ાઇનાન્સ લિમિટેડ(અગાઉ એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)ના ચાર્જને અધીન ગણાશે સિક્યોર્ડ અસ્ક્યામતો છોડાવવાની ઉપલબ્ધ સમયમર્યાદા અંગે સરફૈસી કાયદાના સેક્શન ૧૩ના સબ-સેક્શન(૮ તરફ દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

મિલકતની સૂચિ

સિક્યોર્ડ અસ્ક્યામતની વિગતોઃ મિલકત તે ફ્લેટ નં. એલ- ૧૦૩ધારક, ૧લે માળે, બ્લોક-એલ, કેપી રેસિડર્ન્સ ટીપીએસ નં. ૧૧૯ એફપી નં. ૧૨૮/૨, મોજે નિકોલ તાલુકોઃ અસારવા, જિલ્લો પેટા જિલ્લો અમદાવા (માપણી લગભગ ૬૧.૩૭ ચો.મી. અને અવિભાજિત હિસ્સો જમીનમાં ૨૦.૩૪ -ચો.મી.) ના તમાર . કક્કહિસ્સા. અને સીમાઓઃ ઉત્તરેઃ સોસાયટી ઇન્ટરનલ કોમન રોડ, દક્ષિણેઃ ફ્લેટ નં.એલ-૧૦૪, પૂર્વેઃ સોસાયર્ટ કોમન દીવાલ, પશ્ચિમેઃ ફ્લેટ નં.એલ-૧૦૨

સહી/- અધિકૃત અધિકારી વતી નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉ એડેલવેઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)

GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED CIN: L27101GJ1994PLC022876 B-701, Nirman Complex, B/h. Navrangpura Bus Stand, Ahmedababd-380009 GJ II EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL

RESULTS FOR THE QUARTER ENDED ON 30.09.2024 (Rs. in Lacs)

Sr		Quarter ended on 30-09-2024	Quarter ended on 30-09-2023	Half Year ended on 30-09-2024	Year ended on 31-03-2024
1 2	Total Income from Operations Net Profit / (Loss) for the period	23.50	275.25	177.52	419.38
3	(before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period	-5.14	5.76	-1.1	5.52
4	before Tax (after Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period	-5.14	5.76	-1.10	5.52
	after Tax (after Exceptional and / or Extraordinary items)	-5.14	5.76	-1.10	5.52
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive				
	Income (after tax)]	0.00	0.00	0.00	0.00
7	Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited	491.71	491.71	491.71	491.71
8	Balance Sheet of Previous Year Earnings Per Share	-557.65	-557.65	-557.65	-557.65
	(of Rs.10/- each) (for continuing and discontinued operations)	0.40	0.40	0.00	0.44
	Basic:	-0.10	0.12	-0.02	0.11
	Diluted:	-0.10	0.12	-0.02	0.11

Notes: (1) The above is an extract of the detailed format of Quarterly Financia Notes: (1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.oppaliron.in)
(2) The result of the Quarter ended on 30th September, 2024 were reviewed by the Audit

Committee and approved by the Board of Director at its meeting held on 11-11-2024 By Order of the Board of Directors

For, Gopal Iron and Steels Company (Gujarat) Limited sd/- Ms. Kundanben Patel Date: 11/11/2024

Aksharchem (India) Limited Regd. Office: 'Akshar House', Chhatral-Kadi Road, Indrad – 382 715, Mahesana, Gujarat

Tel : +91 2764 233007/08/09/10,
Website: www.aksharchemindia.com, e-mail ID: cs@aksharchemindia.com, CIN: L24110GJ1989PLC012441

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024

			Rs. in lal	khs except EPS
Sr. No.	Particulars	Quarter Ended 30/09/2024 (Unaudited)	Quarter Ended 31/09/2023 (Unaudited)	Half Year Ended 30/09/2024 (Unaudited)
1.	Total Income from Operations	7,893.31	7,329.88	16,484.14
2.	Net Profit for the period (before tax and exceptional items)	140.60	(754.71)	299.37
3.	Net Profit for the period before tax (after exceptional items)	140.60	(754.71)	299.37
4.	Net Profit for the period after tax (after exceptional items)	104.12	(760.38)	219.28
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	104.16	(760.33)	219.92
6.	Paid up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	803.31	803.31	803.31
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	-	-	-
8.	Earnings per share (for Continuing and discontinued operations) Basic Diluted	1.30 1.30	(9.47) (9.47)	2.73 2.73

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results will be available on the Stock Exchange website namely www.nseindia.com and www.nseindia.com and also on the Company's website at www.aksharchemindia.com.

For and on behalf of Board of Directors Aksharchem (India) Limited

Mrs. Paru M. Jaykrishna

Place: Ahmedabad Chairperson & Mg. Director DIN: 00671721 Date: November 12, 2024























